

પીએમ વિદ્યાલક્ષ્મી ડિજિટલ રૂપી એપ (CBDC વૉલેટ)

ભારતીય રિઝર્વ બેંકના
સેન્ટ્રલ બેંક ડિજિટલ
કરન્સી (CBDC) કાર્યક્રમ
હેઠળ પાયલોટ પહેલ.

વિદ્યાર્થીઓને વ્યાજ
સબવેન્શન ક્રેડિટ સીધી
પીએમ વિદ્યાલક્ષ્મી ડિજિટલ
રૂપી વૉલેટમાં મળે છે.

વિદ્યાર્થીએ પોતાના રજિસ્ટર્ડ આધાર લિંકડ
મોબાઇલ ફોનમાં પીએમ વિદ્યાલક્ષ્મી ડિજિટલ
રૂપી એપ ડાઉનલોડ કરવાની રહેશે. લોન અને વ્યાજ
સબવેન્શનની સરળ પ્રક્રિયા માટે આધાર લિંકડ
મોબાઇલ નંબરનો ઉપયોગ કરવો પડશે.

દર વર્ષે, વિદ્યાર્થીએ પીએમ
વિદ્યાલક્ષ્મી ડિજિટલ રૂપી
વૉલેટમાં ઈ ₹ પ્રાપ્ત થયાના 30
દિવસની અંદર તેના/તેની શિક્ષણ
લોન ખાતામાં ઈ ₹ ટ્રાન્સફર કરવાની
મંજૂરી આપવી પડશે.

આ એપ્લિકેશન પ્રમાણિકતા,
વ્યવહાર ટ્રેસેબિલિટીમાં વધારો
કરે છે અને પારદર્શક ભંડોળ
ઉપયોગ સુનિશ્ચિત કરે છે.

જરૂરી દસ્તાવેજો



અરજી માટે આધાર કાર્ડ, લોન આપતા
પહેલા પાન કાર્ડ



પાસપોર્ટ સાઇઝનો રંગીન ફોટો (જો જરૂરી
હોય તો વિદ્યાર્થી અને સહ-અરજદાર)



માર્કશીટ + ધોરણ દસમા, બારમા, સ્નાતક
અથવા છેલ્લા લાયકાત પરીક્ષા માટે
પ્રમાણપત્ર-સેમેસ્ટર મુજબ



ખર્ચના સમયપત્રક સાથે પ્રવેશ /
ઓફર લેટર



સરકારના સક્ષમ અધિકારી
(તહસીલદાર/SDM કોર્ટ) તરફથી
આવકનું પ્રમાણપત્ર - ફક્ત તે લોકો
માટે જ લાગુ પડે છે જેઓ વ્યાજ
સહાય માટે પાત્ર છે.



અરજી કરવા માટે સ્કેન કરો

ભારતના યુવાનોનું સશક્તિકરણ





પીએમ વિદ્યાલક્ષ્મી યોજના

દેશની **860** ઉચ્ચ ગુણવત્તાવાળી શૈક્ષણિક સંસ્થાઓ (QHEIS) માટે શિક્ષણ લોન યોજના
<https://www.education.gov.in/scholarships-education-loan-4>

કોલેટરલ ફ્રી અને ગેરેંટી ફ્રી શિક્ષણ લોન.

ભારત સરકાર દ્વારા
₹7.50 લાખ સુધીની લોન **75%** કેડિટ ગેરેંટી સાથે પૂરી પાડવામાં આવશે.

એક સરળ, પારદર્શક, વિદ્યાર્થી-મૈત્રીપૂર્ણ અને સંપૂર્ણપણે ડિજિટલ પ્રક્રિયા.

₹4.50 લાખ સુધીની વાર્ષિક ધરસત્ય આવક ધરાવતા વિદ્યાર્થીની વ્યાવસાયિક કે ટેકનિકલ કોર્સ માટે મોરેટોરિયમ અવધિ દરમિયાન સંપૂર્ણ વ્યાજમાં રાહત મળશે. તેથી વધુમાં **₹8.00** લાખ સુધીની આવક ધરાવનારા તમામ અભ્યાસક્રમો માટે,

₹10 લાખ સુધીના લોન પર **3%** વ્યાજ સબસિડી મળશે.

વ્યક્તિગત બેંકના બાહ્ય બેન્ચમાર્ક લેન્ડિંગ રેટ (EBLR) + **0.5%** સુધી મર્યાદિત વ્યાજ દર.

ઓનલાઇન અરજી કરો:
www.pmvidyalaxmi.co.in

PM USP CSIS (કેન્દ્રીય ક્ષેત્ર વ્યાજ સબસિડી યોજના)

₹10 લાખ સુધીની લોન પર **₹4.50** લાખ રૂપિયા સુધીની વાર્ષિક કૌટુંબિક આવક ધરાવતા વિદ્યાર્થીઓ માટે સંપૂર્ણ વ્યાજ સહાય.

આ યોજના, યોજના માર્ગદર્શિકા અનુસાર લાયકાત ધરાવતા સંસ્થાઓ/યુનિવર્સિટીઓમાં વ્યાવસાયિક/તકનીકી અભ્યાસક્રમોમાં નોંધાયેલા વિદ્યાર્થીઓ માટે લાગુ પડે છે.

આ યોજના બધી અનુસૂચિત બેંકો/પ્રાદેશિક ગ્રામીણ બેંકો (RRBs)/ સહકારી બેંકો માટે લાગુ પડે છે.

વધુ માહિતી માટે,
<https://www.education.gov.in/scholarships-education-loan-4> ની મુલાકાત લો.

